

M.A. (PSYCHOLOGY) Semester - 3 (CBCS) Examination
Oct/Nov-2021 (NEW COURSE)
Behavior Modification (Elective-5 (New))

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	વર્તન ફેરફાર એટલે શું? તેના પાયાના ખ્યાલ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	વર્તન ફેરફારના આધારસ્તંભ સમજાવો.	
પ્રશ્ન.૨	પરંપરાગત મુલ્યાંકન અને વાર્તાનીક મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	ઔપચારિક અને અનોપચારિક વર્તન વિશ્લેષણ સમજાવો.	
પ્રશ્ન.૩	ક્રમબદ્ધ અસંવેદનીકરણ વિસ્તાર પૂર્વક સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	મોડેલીંગ અને વાર્તાનીક પૂર્વતાલીમ ચર્ચો.	
પ્રશ્ન.૪	પ્રબલન એટલે શું? તેના પ્રકાર ચર્ચો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	પ્રબલનના ઉપક્રમોની ચર્ચા કરો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	1. વિશ્રાંતિની પ્રયુક્તિ	
	2. વર્તન વિશ્લેષણના હેતુ	
	3. દૃઢાગ્રહ તાલીમ	
	4. સંભાવ્ય સ્થિતિઓના પ્રબંધ	

ENGLISH VERSION

Q.1	What is behaviour modification? Explain it's basic concepts.	(14)
	OR	
Q.1	Explain the foundations of behaviour modification.	
Q.2	Explain the difference between traditional assessment and behavioural assessment.	(14)
	OR	
Q.2	Explain formal and informal behavioural assessment.	
Q.3	Explain systematic desensitization.	(14)
	OR	
Q.3	Discuss the modelling and behaviour rehearsal procedures.	
Q.4	What is reinforcement? Explain it's types.	(14)
	OR	
Q.4	Discuss schedules of reinforcement.	
Q.5	Write short notes. (Any Two)	(14)
	1. Techniques of relaxation.	
	2. Purpose of behaviour assessment.	
	3. Assertiveness training	
	4. Contingency management	
